https://archive.org/details/bk1477/page/n0/mode/1up

2010-06-20 -Dakshin Bharat Resolution against Satpanth (1477)

All Items on https://archive.org/details/realpatidar

"નિસ્વાર્થ કાર્ય, એજ સમાજ સેવા" ॥ શ્રી ઉમિયાયે નમઃ ॥ "વિના સહકાર, નહીં ઉદ્ધાર"

tidar.com

# Shri Dakshin Karnataka Patidar Samaj

## શ્રી દક્ષીણ કર્ણાટક પાટીદાર સમાજ, બેંગલોર

" SRI UMIYA BHAVAN " # 980, Service Road, R.P.C. Layout, Vijayanagar, 2nd Stage, Bangalore - 560 040. ☎: 23301556

Full Library on https://realpatidar.com/library

President : Nanji Bhai Valji Limbani, Mysore Road, B'lore (O) 26745490 (R) 23351414 (M) : 9448495050

Arjun Bhai Hirji Sankhala, Mandya Bangalore (O) 28483527 (R) 9480447448 (M) : 9448273375

Chiman Bhai Nanji Limbani, Mysore Road, B'lore. (O) 26747755 (R) 23507136 (M) : 9448458755

Imm. Past President : Keshavalal Bhai Virji Pokar, Peenya (O) 28391232 (R) 28370557 (M) 9448270308

Vice President : Khimji Premji Pokar, Nelamangala (O) 27722110 (R) 27723390 (M) 9844156643

Secretary : Manilal Bhimji Limbani, Yalahanka (O) 28460339 (R) 28460221 (M) 9341257157

Treasurer : Vasant Bhai Keshavlal Gorani, Udupi (O/R) 0820-2529608 (M) 9845230301

Auditor : Purushotham Devji Bathani, Davanagere (O) 275088 (M) 9845277088

Imm. Past Gen. Secretary : Dhanji Bhai Manji Chhabhaiya, Peenya (O)28395043,28396120(R)28396238(M) 9900181865

**Committee Member**

Ex. General Secratary :
Manjunath Valji Rudani, Harihara
(O) 242225 (R)241325 (M) 9448451325
Dinesh Bhai Shivji Chhabhaiya, Davanagere
(O) 255435 (R) 255995 (M) 9448754140
Ramesh Bhai Hansraj Pokar, Mandya
(O) 225530 (R)227254 (M) 9448316773
Babu Bhai Jivraj Ramani , Ramanagar
(O) 27273922 (R) 27271727
Chandulal Velji Sankhala, Mysore
(O)0821-2482859 (R) 2482050 (M) 9845122050
Gopal Sivji Sankhala, Mysore
(O) 2495931 (R) 2495755 (M) 9448271755
Lalji Dana Jabvani, Rajajinagar
(O)23377632 (R) 23472025 (M) 9448305048
Parbat Devji Sankhala, Rajajinagar
(O)23288370 (R)9900168732. (M) 9448352021
Jitendra Ratansi Pokar, Magadi
(O)080-7745578(R)77455178(M)9448085278
Nathu Dana Vasani, Lalbag
(O)26587981 (R) 26583323 (M) 9844123320
Premji Harji Chhabhaiya, Lalbag
(O)28523017(R)51119753 (M)9341218578
Pursotham Manji Ravani, K.R. Puram
(O)25612956 (R)9845932201 (M) 9740085111
Ramesh Kheta Pokar, K.R. Puram
(O)25650993 (R) 25424814 (M) 9844011345
Veerji Naran Bhavani, Doddabalapur
(O)080-27624226 (R)27689577 (M)9448761608
Vishram Shivdas Bhagat, Nelamangla
(O) 27723644(R)27722633 (M) 9341236543
Dinesh Kesara Limbani, Indiranagar
(O)25367536 (R)25294357 (M) 9449863351
Jhethalal Bhimji Limbani, Indiranagar
(O)25681544(R) 65681545 (M) 9845120544
Somji Megji Nathani, Udupi
(O)0820-2528231 (R)2524541 (M)9448138231.
Shivdas Mulji Ravani, Bhadravathi, Maddur
(O)08282-263601 (M) 9448146491
Khimji Shivji Limbani, Hassan
(O) 08172-256470 (R)256493 (M)9980435906
Somji Jivraj Pokar, Kolar
(O R.) 08152-240288 (M) 9448135388
Kanthilal Nanji Pokar, Mulbagalu
(O)08152-242453 (R)242653 (M) 9449259458
Hirji Dalya Chhabhaiya, Tumkur
(O) 0816-2281363 (R)2280195 (M) 9448370195
Lakhamsi Dhanji Ravani, Gubbi
(O) 08131-222742 (R)222853 (M) 9964096572
Karsan Premji Pokar, Peenya, Bangalore
(O)41170026 (R) 28396645 (M) 9945535121
Premji Karsan Chhabhaiya, Peenya, Bangalore
(O) 28395532 (R) 28391898 (M) 9448386532
Kantilal Pachan Vadiya, Hiriyur
(O)08193-227239(R)228729 (M) 9448194777
Kishor Ratansi Gorani, Holalkere
(O)08191-275142 (R)275942 (M) 9448485056
Lakhamsi Raja Diwani, Yalahanka
(O) 23636633 (R) 28560983 (M)9845290603
Ravilal Lakhamsi Ramani, Yalahanka
(O) 23636911 (R)23543446 (M) 9448385109

(૧) सत्यमेव जयते

Ref No. Date : તા. ૨૦-૬-૨૦૧૦

॥ श्री सनातन धर्मो धर्म रक्षित ॥

પ્રતિ,

............................................................

શ્રી દક્ષિણ કર્ણાટક કડવા પાટીદાર સમાજ, બેંગલોર ના હોદ્દેદારો અને તેના અંતરગત આવતી ૧૭ (સત્તર) સમાજોના ત્રણે પાંખોના પ્રમુખ મંત્રીશ્રીઓ, હોદ્દેદારો, કારોબારીશ્રીઓ, ઝોનલ પ્રતિનિધીશ્રીઓ તેમજ કેન્દ્રીય સમાજના આપણા કારોબારી સભ્યોશ્રીઓની સભાના સભાધ્યક્ષ, શ્રી દ.ક.ક.પા. સમાજના પૂર્વ પ્રમુખ શ્રી કેશવલાલ કાનજી ભગત, ખોંભડી, બેંગલોર ના અધ્યક્ષ સ્થાને તા. ૨૦-૬-૨૦૧૦ ને રવિવાર ના બપોરે ૩:૦૦ કલાકે શ્રી ઉમિયા ભવન બેંગલોર મધ્યે બોલાવેલ સભામાં સર્વાનુમતે નીચે મુજબના ઠરાવો પસાર કરવામાં આવેલ છે.

આ ઠરાવો તાજેતરમાં કેન્દ્રીય સમાજે તા. ૨૫-૩-૨૦૧૦ ના બહાર પાડેલ શ્વેતપત્ર, તા. ૭-૫-૨૦૧૦ ના અસાધારણ સામાન્ય સભામાં (Extra Ordinery Generai Body Meeting) સર્વાનુમતે બંધારણમાં કરેલ સુધારાઓ અને તા. ૧૨-૫-૨૦૧૦ ના જ્ઞાતિ પંચમ અધિવેશનમાં સર્વાનુમતે પસાર કરેલ જ્ઞાતિ રીતી-રિવાજો ની ૧ થી ૧૯ કલમો વગેરેને અખીલ ભારતીય ઝોન એવમ્ સમાજ સ્તરે પાલન કરાવવા માટે નીચે મુજબના ઠરાવો પસાર કરવામાં આવેલ છે.

ઠરાવ નં ૧. : શ્રી દ.ક.ક.પા. સમાજ અંતરગત આવતી ૧૭ સમાજોને કેન્દ્રીય સમાજે તા. ૨૫-૩-૨૦૧૦ ના બહાર પાડેલ શ્વેતપત્રને અનુરૂપ વર્તન કરવાનું રહેશે અને આ શ્વેતપત્રનું યોગ્ય રીતે લેમીનેશન કરાવી દરેક સમાજોના કાર્યાલયમાં યોગ્ય જગ્યાએ પ્રદર્શીત કરવાનું આ સભા અત્રેથી ઠરાવે છે.

ઠરાવ નં ૨. : આપણી કેન્દ્રીય સમાજે તા. ૭-૫-૨૦૧૦ ની અસાધારણ સામાન્ય સભામાં સર્વાનુમતે પસાર કરેલ બંધારણમાં સુધારાઓને ધ્યાનમાં લેતાં આ સમાજ (શ્રી દ.ક.ક.પા. સમાજ) સર્વાનુમતે તેના નામમાં "શ્રી લક્ષ્મીનારાયણ સનાતન" શબ્દોનો સમાવેશ કરવાનું ઠરાવે છે. તે મુજબ આજથી આપણી આ સમાજનું નામ "શ્રી દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ" રાખવામાં આવે છે.

ઠરાવ નં ૩. : કેન્દ્રીય સમાજે પસાર કરેલ નવા બંધારણ મુજબ આ સમાજનું વ્યક્તિગત સભ્યપદ એવી વ્યક્તિઓને જ આપવામાં આવશે કે જેઓ કચ્છ કડવા પાટીદારના વંશજો હશે અને સનાતન હિન્દુ ધર્મ હેઠળ શ્રી લક્ષ્મીનારાયણ અથવા તો શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય અથવા આર્ય સમાજ સંપ્રદાયમાં માનતા અને અનુસરતા હશે. તેજ પ્રમાણે સમાજ સભ્યપદ એવી સમાજોને જ આપવામાં આવશે જે કે સમાજોના દરેક સભ્યો

realpatidar.com

" સમાજે આપણા માટે શું કર્યું છે, તેના બદલે આપણે સમાજ માટે શું કર્યું છે, અને શું કરવું જોઈએ, તે વિચારીએ."

https://archive.org/details/bk1477/page/n1/mode/1up

# Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

## About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com - Created using: Create-D-File-Step2.pyw (v51)
Created on: 2026-04-11T18:27:48

https://archive.org/details/bk1477/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.04.11 18:27:54 +05'30'

Real Patidar
Unravel Truth



" નિસ્વાર્થ કાર્ય, એજ સમાજ સેવા" || શ્રી ઉમિયાયે નમઃ || " વિના સહકાર, નહીં ઉદ્ધાર "

realpatidar.com

# Shri Dakshin Karnataka Patidar Samaj

## શ્રી દક્ષીણ કર્ણાટક પાટીદાર સમાજ, બેંગલોર

" SRI UMIYA BHAVAN " # 980, Service Road, R.P.C. Layout, Vijayanagar, 2nd Stage, Bangalore - 560 040. ☎: 23301556

Hon. President: Nanji Bhai Valji Limbani, Mysore Road, B'lore
(O) 26745490 (R) 23351414 (M) : 9448495050
Arjun Bhai Hirji Sankhala, Mandya Bangalore
(O) 28483527 (R) 9480447448 (M) : 9448273375
Chiman Bhai Nanji Limbani, Mysore Road, B'lore.
(O) 26747755 (R) 23507136 (M) : 9448458755
Imm. Past President: Keshavalal Bhai Virji Pokar, Peenya
(O) 28391232 (R) 28370557 (M) 9448270308

Vice President : Khimji Premji Pokar, Nelamangala
(O) 27722110 (R) 27723390 (M) 9844156643
Secretary : Manilal Bhimji Limbani, Yalahanka
(O) 28460339 (R) 28460221 (M) 9341257157
Treasurer : Vasant Bhai Keshavlal Gorani, Udupi
(O/R) 0820-2529608 (M) 9845230301
Auditor : Purushotham Devji Bathani, Davanagere
(O) 275088 (M) 9845277088
Imm. Past Gen. Secretary : Dhanji Bhai Manji Chhabhaiya, Peenya
(O)28395043,28396120(R)28396238(M) 9900181865

Committee Member
Ex. General Secretary :
Manjunath Valji Rudani, Harihara
(O) 242225 (R)241325 (M) 9448451325
Dinesh Bhai Shivji Chhabhaiya, Davanagere
(O) 255435 (R) 255995 (M) 9448754140
Ramesh Bhai Hansraj Pokar, Mandya
(O) 225530 (R)227254 (M) 9448316773
Babu Bhai Jivraj Ramani , Ramanagar
(O) 27273922 (R) 27271727
Chandulal Velji Sankhala, Mysore
(O)0821-2482859 (R) 2482050 (M) 9845122050
Gopal Sivji Sankhala, Mysore
(O) 2495931 (R) 2495755 (M) 9448271755
Lalji Dana Jabvani, Rajajinagar
(O)23377632 (R) 23472025 (M) 9448305048
Parbat Devji Sankhala, Rajajinagar
(O)23288370 (R)9900168732. (M) 9448352021
Jitendra Ratansi Pokar, Magadi
(O)080-7745578(R)77455178(M)9448085278
Nathu Dana Vasani, Lalbag
(O)26587981 (R) 26583323 (M) 9844123320
Premji Harji Chhabhaiya, Lalbag
(O)28523017(R)51119753 (M)9341218578
Pursotham Manji Ravani, K.R. Puram
(O)25612956 (R)9845932201 (M) 9740085111
Ramesh Kheta Pokar, K.R. Puram
(O)25650993 (R) 25424814 (M) 9844011345
Veerji Naran Bhavani, Doddabalapur
(O)080-27624226 (R)27689577 (M)9448761608
Vishram Shivdas Bhagat, Nelamangla
(O) 27723644(R)27722633 (M) 9341236543
Dinesh Kesara Limbani, Indiranagar
(O)25367636 (R)25294357 (M) 9449863351
Jhethalal Bhimji Limbani, Indiranagar
(O)25681544(R) 65681545 (M) 9845120544
Somji Megji Nathani, Udupi
(O)0820-2528231 (R)2524541 (M)9448138231
Shivdas Mulji Ravani, Bhadravathi, Maddur
(O)08282-263601 (M) 9448146491
Khimji Shivji Limbani, Hassan
(O) 08172-256470 (R)256493 (M)9980435906
Somji Jivraj Pokar, Kolar
(O R.) 08152-240298 (M) 9448135388
Kanthilal Nanji Pokar, Mulbagalu
(O)08152-242453 (R)242553 (M) 9449259458
Hirji Dalya Chhabhaiya, Tumkur
(O) 0816-2281363 (R)2280195 (M) 9448370195
Lakhamsi Dhanji Ravani, Gubbi
(O) 08131-222742 (R)222653 (M) 9964096572
Karsan Premji Pokar, Peenya, Bangalore
(O)41170026 (R) 28396645 (M) 9845535121
Premji Karsan Chhabhaiya, Peenya, Bangalore
(O) 28395532 (R) 28391898 (M) 9448386532
Kantilal Pachan Vadiya, Hiriyur
(O)08193-227239(R)228729 (M) 9448194777
Kishor Ratansi Gorani, Holalkere
(O)08191-275142 (R)275942 (M) 9448485056
Lakhamsi Raja Diwani, Yalahanka
(O) 23636633 (R) 28560983 (M)9845290603
Ravilal Lakhamsi Ramani, Yalahanka
(O) 23636911 (R)23543446 (M) 9448385109

(૧) सत्यमेव जयते

Ref No.

Date : ......તા. ૨૦-૬-૨૦૧૦

|| श्री सनातन धर्मो धर्म रक्षित ||

પ્રતિ,

..................................................................................... ✓

શ્રી દક્ષિણ કર્ણાટક કડવા પાટીદાર સમાજ, બેંગલોર ના હોદ્દેદારો અને તેના અંતરગત આવતી ૧૭ (સત્તર) સમાજોના ત્રણે પાંખોના પ્રમુખ મંત્રીશ્રીઓ, હોદ્દેદારો, કારોબારીશ્રીઓ, ઝોનલ પ્રતિનિધીશ્રીઓ તેમજ કેન્દ્રીય સમાજના આપણા કારોબારી સભ્યોશ્રીઓની સભાના સભાધ્યક્ષ, શ્રી દ.ક.ક.પા. સમાજના પૂર્વ પ્રમુખ શ્રી કેશવલાલ કાનજી ભગત, ખોંભડી, બેંગલોર ના અધ્યક્ષ સ્થાને તા. ૨૦-૬-૨૦૧૦ ને રવિવાર ના બપોરે ૩:૦૦ કલાકે શ્રી ઉમિયા ભવન બેંગલોર મધ્યે બોલાવેલ સભામાં સર્વાનુમતે નીચે મુજબના ઠરાવો પસાર કરવામાં આવેલ છે.

આ ઠરાવો તાજેતરમાં કેન્દ્રીય સમાજે તા. ૨૫-૩-૨૦૧૦ ના બહાર પાડેલ શ્વેતપત્ર, તા. ૭-૫-૨૦૧૦ ના અસાધારણ સામાન્ય સભામાં (Extra Ordinery Generai Body Meeting) સર્વાનુમતે બંધારણમાં કરેલ સુધારાઓ અને તા. ૧૨-૫-૨૦૧૦ ના જ્ઞાતિ પંચમ અધિવેશનમાં સર્વાનુમતે પસાર કરેલ જ્ઞાતિ રીતી-રિવાજો ની ૧ થી ૧૯ કલમો વગેરેને અખીલ ભારતીય ઝોન એવમ્ સમાજ સ્તરે પાલન કરાવવા માટે નીચે મુજબના ઠરાવો પસાર કરવામાં આવેલ છે.

ઠરાવ નં ૧. : શ્રી દ.ક.ક.પા. સમાજ અંતરગત આવતી ૧૭ સમાજોને કેન્દ્રીય સમાજે તા. ૨૫-૩-૨૦૧૦ ના બહાર પાડેલ શ્વેતપત્રને અનુરૂપ વર્તન કરવાનું રહેશે અને આ શ્વેતપત્રનું યોગ્ય રીતે લેમીનેશન કરાવી દરેક સમાજોના કાર્યાલયમાં યોગ્ય જગ્યાએ પ્રદર્શીત કરવાનું આ સભા અત્રેથી ઠરાવે છે.

ઠરાવ નં ૨. : આપણી કેન્દ્રીય સમાજે તા. ૭-૫-૨૦૧૦ ની અસાધારણ સામાન્ય સભામાં સર્વાનુમતે પસાર કરેલ બંધારણમાં સુધારાઓને ધ્યાનમાં લેતાં આ સમાજ (શ્રી દ.ક.ક.પા. સમાજ) સર્વાનુમતે તેના નામમાં "શ્રી લક્ષ્મીનારાયણ સનાતન" શબ્દોનો સમાવેશ કરવાનું ઠરાવે છે. તે મુજબ આજથી આપણી આ સમાજનું નામ "શ્રી દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ" રાખવામાં આવે છે.

ઠરાવ નં 3. : કેન્દ્રીય સમાજે પસાર કરેલ નવા બંધારણ મુજબ આ સમાજનું વ્યક્તિગત સભ્યપદ એવી વ્યક્તિઓને જ આપવામાં આવશે કે જેઓ કચ્છ કડવા પાટીદારના વંશજો હશે અને સનાતન હિન્દુ ધર્મ હેઠળ શ્રી લક્ષ્મીનારાયણ અથવા તો શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય અથવા આર્ય સમાજ સંપ્રદાયમાં માનતા અને અનુસરતા હશે. તેજ પ્રમાણે સમાજ સભ્યપદ એવી સમાજોને જ આપવામાં આવશે જે કે સમાજોના દરેક સભ્યો

realpatidar.com

" સમાજે આપણા માટે શું કર્યું છે, તેના બદલે આપણે સમાજ માટે શું કર્યું છે, અને શું કરવું જોઈએ, તે વિચારીએ."

realpatidar.com

…ર્ય કાર્ય, એજ સમાજ સેવા" || શ્રી ઉમિયાયે નમઃ || " વિના સહકાર, નહીં ઉદ્ધાર "

# …hri Dakshin Karnataka Patidar Samaj

## શ્રી દક્ષીણ કર્ણાટક પાટીદાર સમાજ, બેંગલોર

" SRI UMIYA BHAVAN " # 980, Service Road, R.P.C. Layout, Vijayanagar, 2nd Stage, Bangalore - 560 040. ☎: 23301556

…ion President : Nanji Bhai Valji Limbani, Mysore Road, B'lore (O) 26745490 (R) 23351414 (M) : 9448495050
Arjun Bhai Hirji Sankhala, Mandya Bangalore (O) 28483527 (R) 9480447448 (M) : 9448273375
Chiman Bhai Nanji Limbani, Mysore Road, B'lore (O) 26747755 (R) 23507136 (M) : 9448458755
…resident : Keshavalal Bhai Virji Pokar, Peenya (O) 28391232 (R) 28370557 (M) 9448270308

Vice President : Khimji Premji Pokar, Nelamangala (O) 27722110 (R) 27723390 (M) 9844156643
Secretary : Manilal Bhimji Limbani, Yalahanka (O) 28460339 (R) 28460221 (M) 9341257157
Treasurer : Vasant Bhai Keshavlal Gorani, Udupi (O/R) 0820-2529608 (M) 9845230301
Auditor : Purushotham Devji Bathani, Davanagere (O) 275088 (M) 9845277088
Imm. Past Gen. Secretary : Dhanji Bhai Manji Chhabhaiya, Peenya (O)28395043,28396120(R)28396238(M) 9900181865

Committee Member

Ex. General Secretary :
Manjunath Valji Rudani, Harihara
(O) 242225 (R)241325 (M) 9448451325
Dinesh Bhai Shivji Chhabhaiya, Davanagere
(O) 255435 (R) 255995 (M) 9448754140
Ramesh Bhai Hansraj Pokar, Mandya
(O) 225530 (R)227254 (M) 9448316773
Babu Bhai Jivraj Ramani , Ramanagar
(O) 27273922 (R) 27271727
Chandulal Velji Sankhala, Mysore
(O)0821-2482859 (R) 2482050 (M) 9845122050
Gopal Sivji Sankhala, Mysore
(O) 2495931 (R) 2495755 (M) 9448271755
Lalji Dana Jabvani, Rajajinagar
(O)23377632 (R) 23472025 (M) 9448305048
Parbat Devji Sankhala, Rajajinagar
(O)23288370 (R)9900168732, (M) 9448352021
Jitendra Ratansi Pokar, Magadi
(O)080-7745578(R)77455178(M)9448085278
Nathu Dana Vasani, Lalbag
(O)26587981 (R) 26683323 (M) 9844123320
Premji Harji Chhabhaiya, Lalbag
(O)28523017(R)51119753 (M)9341218578
Pursotham Manji Ravani, K.R. Puram
(O)25612958 (R)9845932201 (M) 9740085111
Ramesh Kheta Pokar, K.R. Puram
(O)25650993 (R) 25424814 (M) 9844011345
Veerji Naran Bhavani, Doddabalapur
(O)080-27624226 (R)27689577 (M)9448761808
Vishram Shivdas Bhagat, Nelamangla
(O) 27723644(R)27722633 (M) 9341238543
Dinesh Keshra Limbani, Indiranagar
(O)25367836 (R)25294357 (M) 9449863351
Jhathalal Bhimji Limbani, Indiranagar
(O)25681544(R) 65681545 (M) 9845120544
Somji Megji Nathani, Udupi
(O)0820-2528231 (R)2524541 (M)9448138231
Shivdas Mulji Ravani, Bhadravathi, Maddur
(O)08282-263601 (M) 9448146491
Khimji Shivji Limbani, Hassan
(C) 08172-256470 (R)256493 (M)9980435906
Somji Jivraj Pokar, Kolar
(O.R.) 08152-240288 (M) 9448185388
Kanthilal Nanji Pokar, Mulbagalu
(O)08152-242453 (R)242653 (M) 9449259458
Hirji Daiya Chhabhaiya, Tumkur
(O) 0816-2281363 (R)2280195 (M) 9448370195
Lakhamsi Dhanji Ravani, Gubbi
(O) 08131-222742 (R)222853 (M) 9964096572
Karsan Premji Pokar, Peenya, Bangalore
(O)41170026 (R) 28396545 (M) 9945535121
Premji Karsan Chhabhaiya, Peenya, Bangalore
(O) 28396532 (R) 28391898 (M) 9448386532
Kantilal Pachan Vadiya, Hiriyur
(O)08193-227239(R)228729 (M) 9448194777
Kishor Ratansi Gorani, Holalkere
(O)08191-275142 (R)275942 (M) 9448485056
Lakhamsi Raja Diwani, Yalahanka
(O) 23636633 (R) 28560983 (M)9845290603
Ravilal Lakhamsi Ramani, Yalahanka
(O) 23636911 (R)23543446 (M) 9448385109

सत्यमेव जयते

Ref No. ( ૨ ) Date : ..............................

શ્રી લક્ષ્મીનારાયણ અથવા તો શ્રી સ્વામીનારાયણ અથવા તો આર્ય સમાજ સંપ્રદાયમાં માનતા અને અનુસરતા હશે. તેજ પ્રમાણે ફર્મ સભ્યપદ એવા ફર્મને જ આપવામાં આવશે કે જેના માલીકો શ્રી લક્ષ્મીનારાયણ અથવા તો શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય અથવા આર્ય સમાજ સંપ્રદાયમાં માનતા અને અનુસરતા હશે. (નોંધ : આપણા પૂર્વજોએ સદાય ને માટે ત્યજી દિધેલ પિરાણા સતપંથ મતમાં માનનારી વ્યક્તિ અથવા તો વ્યક્તિ સમુહની સમાજો અથવા તો તેવી વ્યક્તિઓના ફર્મોને આ સમાજમાં સભ્યપદ આપવામાં આવશે નહીં.)

ઠરાવ નં. ૪ : આ સમાજ હેઠળ આવતી ૧૭ સમાજોને વિનંતી સાથે અનુરોધ કરવામાં આવે છે કે કેન્દ્રીય સમાજ સ્તરે તાજેતરની ગતિવિધીઓને ધ્યાનમાં રાખતાં પોતપોતાની સ્થાનિક સમાજ સ્તરે પણ પોતાની સમાજના નામમાં લક્ષ્મીનારાયણ સનાતન શબ્દનો સમાવેશ કરી તેને અનુરૂપ બંધારણમાં પણ યોગ્ય ફેરફારો સત્વરે કરે જેથી આ સમાજ હેઠળ આવતી તમામ સમાજોમાં એકવાયતા જળવાય એવું અત્રેથી આ સભા સર્વાનુમતે ઠરાવે છે.

ઠરાવ નં. ૫ : આ સમાજ હેઠળ દર વર્ષે યોજાતા સમૂહ લગ્નમાં હવે પછી ફક્ત સનાતન હિન્દુ ધર્મ હેઠળ શ્રી લક્ષ્મીનારાયણ અથવા તો શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયને પાળતા અને અનુસરતા પરિવારોને જ ભાગ લેવા દેવામાં આવશે એવું આ સભા અત્રેથી ઠરાવે છે.

ઠરાવ નં. ૬ : આ સમાજ હેઠળ આવતી તમામ સમાજોના પરિવારોએ આજ દિવસ પછી નવાં સગપણ સાંતરા બાબતે દિકરી લેવાનું અથવા દિકરી દેવાનું શ્રી લક્ષ્મીનારાયણ સનાતન ધર્મ અથવા તો શ્રી સ્વામીનારાયણ સનાતન ધર્મ તેમજ આર્ય સમાજ સંપ્રદાય પાળતા પરિવારો વચ્ચે જ કરવાનું રહેશે. (નોંધ : પિરાણા સતપંથ મતમાં માનનારા પરિવારો સાથે નવા સગપણ સાંતરા નિષેધ ફરમાવવામાં આવે છે.) એવું આ સભા અત્રેથી ઠરાવે છે. આ ઠરાવનું ઉલ્લંઘન કરનાર પરિવાર અથવા તો પરિવારો આ સમાજના ગુનેગાર ગણાશે. આવા પરિવારોને અથવા તો પરિવારને આવાં કૃત્યોમાં સાથ આપનાર વ્યક્તિ અથવા તો વ્યક્તિ સમુહને પણ સમાજના ગુનેગારો ઠેરવવામાં આવશે. એવું આ સભા અત્રેથી સર્વાનુમતે પસાર કરે છે.

realpatidar.com

" સમાજે આપણા માટે શું કર્યું છે, તેના બદલે આપણે સમાજ માટે શું કર્યું છે, અને શું કરવું જોઈએ, તે વિચારીએ."

https://archive.org/details/bk1477/page/n4/mode/1up



“… કાર્ય, એજ સમાજ સેવા” ।। શ્રી ઉમિયાયે નમઃ ।। “વિના સહકાર, નહીં ઉદ્ધાર”

realpatidar.com

# Shri Dakshin Karnataka Patidar Samaj

## શ્રી દક્ષીણ કર્ણાટક પાટીદાર સમાજ, બેંગલોર

" SRI UMIYA BHAVAN " # 980, Service Road, R.P.C. Layout, Vijayanagar, 2nd Stage, Bangalore - 560 040. ☎: 23301556

[illegible] President : Nanji Bhai Valji Limbani, Mysore Road, B'lore (O) 26745490 (R) 23351414 (M) : 9448495050
[illegible] : Arjun Bhai Hirji Sankhala, Mandya Bangalore (O) 28483527 (R) 9480447448 (M) : 9448273375
[illegible] : Chiman Bhai Nanji Limbani, Mysore Road, B'lore. (O) 26747755 (R) 23507136 (M) : 9448458755
[illegible] President : Keshavalal Bhai Virji Pokar, Peenya (O) 28391232 (R) 28370557 (M) 9448270308

Vice President : Khimji Premji Pokar, Nelamangala (O) 27722110 (R) 27723390 (M) 9844156643
Secretary : Manilal Bhimji Limbani, Yalahanka (O) 28460339 (R) 28460221 (M) 9341257157
Treasurer : Vasant Bhai Keshavlal Gorani, Udupi (O/R) 0820-2529608 (M) 9845230301
Auditor : Purushotham Devji Bathani, Davanagere (O) 275088 (M) 9845277088
Imm. Past Gen. Secretary : Dhanji Bhai Manji Chhabhaiya, Peenya (O)28395043,28396120(R)28396238(M) 9900181865

**Committee Member**

Ex. General Secretary :
Manjunath Valji Rudani, Harihara (O) 242225 (R)241325 (M) 9448451325
Dinesh Bhai Shivji Chhabhaiya, Davanagere (O) 255435 (R) 255995 (M) 9448754140
Ramesh Bhai Hansraj Pokar, Mandya (O) 225530 (R)227254 (M) 9448316773
Babu Bhai Jivraj Ramani , Ramanagar (O) 27273922 (R) 27271727
Chandulal Velji Sankhala, Mysore (O)0821-2482859 (R) 2482050 (M) 9845122050
Gopal Sivji Sankhala, Mysore (O) 2495931 (R) 2495755 (M) 9448271755
Lalji Dana Jabvani, Rajajinagar (O)23377632 (R) 23472025 (M) 9448305048
Parbat Devji Sankhala, Rajajinagar (O)23288370 (R)9900168732, (M) 9448352021
Jitendra Ratansi Pokar, Magadi (O)080-7745578(R)77455178(M)9448085278
Nathu Dana Vasani, Lalbag (O)26587981 (R) 26683323 (M) 9844123320
Premji Harji Chhabhaiya, Lalbag (O)28523017(R)51119753 (M)9341218578
Pursotham Manji Ravani, K.R. Puram (O)25612958 (R)9845932201 (M) 9740085111
Ramesh Kheta Pokar, K.R. Puram (O)25650993 (R) 25424814 (M) 9844011345
Veerji Naran Bhavani, Doddabalapur (O)080-27624226 (R)27689577 (M)9448761808
Vishram Shivdas Bhagat, Nelamangla (O) 27723644(R)27722633 (M) 9341238543
Dinesh Keshra Limbani, Indiranagar (O)25367836 (R)25294357 (M) 9449863351
Jhethalal Bhimji Limbani, Indiranagar (O)25681544(R) 65681545 (M) 9845120544
Somji Megji Nathani, Udupi (O)0820-2528231 (R)2524541 (M)9448138231
Shivdas Mulji Ravani, Bhadravathi, Maddur (O)08282-263601 (M) 9448146491
Khimji Shivji Limbani, Hassan (O) 08172-256470 (R)256493 (M)9980435906
Somji Jivraj Pokar, Kolar (O.R.) 08152-240288 (M) 9448185388
Kanthilal Nanji Pokar, Mulbagalu (O)08152-242453 (R)242553 (M) 9449259458
Hirji Daiya Chhabhaiya, Tumkur (O) 0816-2281363 (R)2280195 (M) 9448370195
Lakhamsi Dhanji Ravani, Gubbi (O) 08131-222742 (R)222853 (M) 9964096572
Karsan Premji Pokar, Peenya, Bangalore (O)41170026 (R) 28396645 (M) 9945535121
Premji Karsan Chhabhaiya, Peenya, Bangalore (O) 28396532 (R) 28391898 (M) 9448386532
Kantilal Pachan Vadiya, Hiriyur (O)08193-227239(R)228729 (M) 9448194777
Kishor Ratansi Gorani, Holalkere (O)08191-275142 (R)275942 (M) 9448485056
Lakhamsi Raja Diwani, Yalahanka (O) 23636633 (R) 28560983 (M)9845290603
Navilal Lakhamsi Ramani, Yalahanka (O) 23636911 (R)23543446 (M) 9448385109

Ref No. (3) सत्यमेव जयते Date :..............................

ઠરાવ નં. ૭ : આ સમાજની કોઈ પણ વ્યક્તિએ અથવા તો પરિવારે આજ દિવસ પછી પિરાણા સતપંથ દ્વારા યોજાતા સામાજીક અને ધાર્મિક જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો નહી અને પિરાણે જવું નહીં. જે વ્યક્તિ અથવા તો વ્યક્તિ સમુહ અથવા તો પરિવાર આનું ઉલ્લંઘન કરશે તે સમાજનો ગુનેગાર ગણાશે એવું આ સભા અત્રેથી ઠરાવે છે.

ઠરાવ નં. ૮ : આ સમાજ હેઠળ આવતી તમામ સમાજોના અધિકાર ક્ષેત્રમાં આવતા સનાતની ભાઈઓના ફર્મોને આ સમાજનું ફર્મ સભ્યપદ ફરજીઆત મેળવવાનું રહેશે. આવું સભ્યપદ ન મેળવેલ ફર્મના ભાઈઓને સમાજના જાહેર કાર્યક્રમો જેવાં કે સમૂહ લગ્ન, સરસ્વતી સન્માન અને સામાન્ય સભા વગેરે માં ભાગ લેવા દેવામાં નહીં આવે એવું આ સભા સર્વાનુમતે ઠરાવે છે.

ઠરાવ નં. ૯ : ઉપરોક્ત તમામ ઠરાવો આ સમાજ હેઠળ આવતી તમામ સમાજોને બંધન કરતા રહેશે.

ઠરાવ નં. ૧૦ : ઉપરોક્ત ઠરાવોની નકલો આ સમાજ હેઠળ આવતી તમામ સમાજોને એવમ્ કેન્દ્રીય સમાજને તથા કેન્દ્રીય સમાજ હેઠળ આવતી તમામ ૨૯ ઝોનોને ત્વરીત મોકલાવવામાં આવે તેવું આ સભા અત્રેથી ઠરાવે છે.

ઉપરોક્ત ઠરાવોને શ્રી દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજની હેઠળ આવતી તમામ સમાજો તથા સભામાં ઉપસ્થીત અન્ય પ્રતિનિધીઓએ તેમના હસ્તાક્ષર કરી સંપૂર્ણ અનુમોદન આપેલ છે.

આપશ્રીઓના સહયોગ અને સહકારની અપેક્ષા સાથે આપના વિશ્વાસુઓ

આજની સભાના સભાધ્યક્ષ

(કેશવલાલ કાનજી ભગત)

પ્રમુખશ્રી ઉપ-પ્રમુખશ્રી મહામંત્રીશ્રી

**શ્રી દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, બેંગલોર**

realpatidar.com

“સમાજે આપણા માટે શું કર્યું છે, તેના બદલે આપણે સમાજ માટે શું કર્યું છે, અને શું કરવું જોઇએ, તે વિચારીએ.”